https://archive.org/details/bk1047/page/n0/mode/1up
-Anandpar Meeting -for Laxminarayan Temple Inauguration (1047)
All Items on https://archive.org/details/realpatidar
realpatidar.com
Full Library on https://realpatidar.com/library

॥ ૐ ॥ ૨૧

KJ-BK-3-21

આણંદપર ગામમાં શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનનું મંદીર બંધાતા તેમાં
શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરાવવા માટે પટેલો કાર્યની નોંધ
સંવત ૨૦૨૨ના વૈશાખ સુદ ૨ શુક્રવાર ના રોજે કાર્ય ની પહેલ મળી.
વાડીકો ના નામ—

૧ નાનજી વાલજી	૧૧ જવરાજ કરમશી	૨૧ નથુ વાલજી
૨ કરમશી વાલજી	૧૨ નથુ નાનજી	૨૨ પરસોત્તમ કરશન
૩ હીરજી વાલજી	૧૩ રવજી પેથજી	૨૩ રતનશી ધનજી
૪ શિવજી વાલજી	૧૪ રામજી દેવશી	૨૪ કાનજી ધનજી
૫ ડાયા વાલજી	૧૫ લક્ષ્મણ દેવશી	૨૫ ડાયાભાઈ જેઠા
૬ પ્રેમજી વાલજી	૧૬ વાલજી દેવશી	૨૬ નારણભાઈ ભગવાનજી
૭ ગંગાદાસ નાનજી	૧૭ વાલજી ભાણજી	૨૭ રામજી માવજી
૮ રવજી નાનજી	૧૮ ભાણજી કરશી	૨૮ રામજી મેઘજી
૯ શિવા નાનજી	૧૯ નારાયણ ભાણજી	૨૯ લાલજી વાલજી
૧૦ મુળજી કરમશી	૨૦ ભાણજી મુળજી	

આ કાર્ય વાડીકો એક નામે પ્રમાણે વહેંચણી પસંદ કરી
૧ કોઠાર ખાતે નામ ૨.
કરમશીભાઈ વાલજી - ભા રામજીભાઈ દેવશી

૨ જળયાત્રાના વરઘોડા માટે - રવજી - દેવજી

૩ રસોડા ખાતે મુખ્ય - રતનશીભાઈ ધનજી - ડાયાભાઈ ધનજી
પીરસનાર
૧ નથુ વાલજી - ૨ ગંગાદાસ નાનજી - ૩ રવજી નાનજી - ૪ નથુ વાલજી
૫ વાલજી ભાણજી ૬ લક્ષ્મણ દેવશી

૪ સ્વાગત કમીટી
૧ નાનાલાલ વાલજી - ૨ નથુ નાનજી - ૩ પરસોત્તમ કરશન - ૪ ડાયા જેઠા
૫ મુળજી નારણ ભાણજી - ૬ કાનજી માવજી - ૭ પ્રેમજી વાલજી

એ રીતે કાર્ય ના વહેંચણી કરવામાં હતી તે બાદ સભા [illegible] માં આવ્યા હતા. આ સભાનું પ્રમુખ સ્થાન [illegible] રતનશી [illegible] હતું [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] હતા.

પ્રમુખની સહી
પટેલ રતનશી [illegible]
[illegible]

લેખક
પ. નથુ. શ્રી વાલજી [illegible]

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1047/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 2, 3, 4.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v7.py

|| ૐ || ૨૧

KJ-BK-3-21

ગામ: આનંદપર ગામમાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદીર બંધાવતાં તેમાં
શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના પ્રતિષ્ઠા મહોત્સવ પંચેના કાર્યના નોંધ
શ્રી સંવત ૨૦૦૨ના શ્રાવણ સુદ ૨ શુક્રવાર ના રોજે કાર્યના વહીવટ મળી.

VSA: 10-Aug-1945
Date recorded as per Kutchhi Calendar in which new year

કાર્યવાહકો ના નામ—

૧ નાનજી વાલજી	૧૧ ગંગારામ કરમશી	૨૧ નથુ વાલજી
૨ કરમશી વાલજી	૧૨ નથુ નાનજી	૨૨ પરસોત્તમ કરશન
૩ હીરજી વાલજી	૧૩ રવજી પચાણ	૨૩ રતનશી ધનજી
૪ પ્રેમજી વાલજી	૧૪ રામજી દેવશી	૨૪ કાનજી ધનજી
૫ ડાયા વાલજી	૧૫ લક્ષ્મણ દેવશી	૨૫ ડાયાલાલ જેઠા
૬ પુંજા વાલજી	૧૬ વાલજી દેવશી	૨૬ નારણલાલ ભગવાનજી
૭ ગંગાદાસ નાનજી	૧૭ વાલજી ભાણજી	૨૭ રામજી માવજી
૮ રવજી નાનજી	૧૮ ભાણજી કરશન	૨૮ રામજી મેઘજી
૯ મેઘા નાનજી	૧૯ નારાયણ ભાણજી	૨૯ લાલજી વાલજી
૧૦ મુળજી કરમશી	૨૦ ભાણજી મુળજી	

આ કાર્યવાહકો એ નીચે મુજબ પેટા કમીટી ચુંટી હતી

૧ કોઠાર ખાતે જણ ૨.
કરમશીભાઈ વાલજી - ભા. રામભાઈ દેવશી

૨ જાનૈયાઓ ના ઉતારા ખાતું - રવજી - દેવજી

૩ રસોડા ખાતુ મુખ્ય - રતનશીભાઈ ધનજી - ડાયાભાઈ ધનજી
મદદમાં
૧ નથુ વાલજી - ૨ ગંગારામ નાનજી - ૩ રવજી નાનજી - ૪ નથુ વાલજી
૫ વાલજી ભાણજી ૬ લક્ષ્મણ દેવશી

૪ સ્વાગત કમીટી
૧ નાનજીભાઈ વાલજી - ૨ નથુ નાનજી - ૩ પરસોત્તમ કરશન - ૪ ડાયા જેઠા
૫ મુળજી નારાયણ ભાણજી - ૬ કાનજી માવજી - ૭ પુંજા વાલજી

એ રીતે કાર્યના વહેંચણી કરી હતી તે બાદ શરૂઆત કરવા માટે ભાગ લેવા માં આવ્યા હતા. આ શરૂઆતનું મુખ્ય રોપણ વિધિ રતનશી ભાઈ એ કર્યું હતું તેમ જ ... ... ના હસ્તે ... ... હતા.

મુખીના સહી
પટેલ રતનશી ...
... ...

રોકડ
પા. નથુ ... ...

realpatidar.com

https://archive.org/details/bk1047/page/n3/mode/1up
-Anandpar Meeting -for Laxminarayan Temple Inauguration (1047)

॥ ॐ ॥ ૨૨

KJ-BK-3-22

VSA: 11-Aug-1945

realpatidar.com

સં. ૨૦૦૧ના શ્રાવણ શુદ ૩ શનીવારે ના રોજે કચ્છ-કડવા પાટીદાર
સનાતન સમાજના જાહેર સભા [illegible] હતા. જે એ વખતે
મુજબ કાર્ય ક્રમ [illegible] હતુ. એ સભામાં લગભગ [illegible]
૧૦૦૦ થી ૧૨૦૦ હતા. જેમાં શાંતિ [illegible] સનાતન ધર્મ પાળનાર લોક [illegible]
~~[illegible]~~ હીન્દુ ધર્મ ના સભાએ આ ધર્મ સંબંધી દાખલા આ ~~[illegible]~~ જાણ
[illegible] શાંતિના [illegible] ના ભાષણ થયા હતા. [illegible]
પ્રમુખ સ્થાન [illegible] [illegible] [illegible] લીધુ હતુ. તે વખતે
તરફે [illegible] [illegible] [illegible] [illegible]
સુધારા [illegible] કરવા હતા. [illegible] ૧૧ થી ૧૨ વાગે સભા
[illegible] પુરી થયુ હતુ ~~[illegible]~~

~~[illegible]~~ શનીવાર ના સભાના ભાગમાં નીચે મુજબ કાર્ય ક્રમ જાહેર
કર્યુ હતુ

૧ સવારના ૮ થી [illegible] મંદિરમાં પુજન [illegible] થયુ હતુ
૨ બપોરના ૧૨ થી ૧ વાગા સુધી ભોજન પ્રસાદ
૩ બપોરપછી ૨ થી ૩ા વાગા સુધી આરામ
૪ બપોર પછી ૩ થી ૫ (સભા) [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] કરાવ્યુ હતુ. ને તે બાદ [illegible] હતા
૫ સાંજના ૬ થી ભોજન પ્રસાદ. તેમાં [illegible] ને રાત્રે
રાત્રે [illegible] [illegible] હતા.

VSA: 12-Aug-1945

સં. ૨૦૦૧ના શ્રાવણ શુદ ૪ રવીવાર નુ કાર્યક્રમ
૧ [illegible] સવારમાં [illegible]
બાદ [illegible] આવ્યુ હતુ.
૨ સવારમાં [illegible]
ને [illegible] મુર્તિઓના પ્રાણ
પ્રતિષ્ઠા કરવામાં આવેલ તે બાદ હવનના શરૂઆત કરી
હતી જે કાર્ય ૧૧ વાગે પુરો થયુ હતુ.
૩ ૧૧ વાગા બાદ ભોજન પ્રસાદ
૪ ભોજન પ્રસાદ બાદ ૧ થી ૩ વાગા સુધી આરામ,
૫ [illegible] [illegible] [illegible]
[illegible] કરવામાં આવેલ જેમાં [illegible]

realpatidar.com

https://archive.org/details/bk1047/page/n4/mode/1up

KJ-BK-3-23

realpatidar.com

ઘર ના લોકો એ ત્યાં ફુલ વરસાવ્યા બહુજ સારી રીતે પોતાના દરવાજા
હતા ને તે [illegible] ઉદારતા દેખાડી ને પુષ્પ પ્રેમથી ઘણો કાળ
ગાળ્યા. શાન્તિ લીધી. વહીવટ આનંદથી એમાં આવેલ તે બધા ના
પ્રેમનું સાક્ષાત. પુષ્પ સત્સંગ ને લક્ષ્મી ના સમાગમ ના જોવું હતું
ને ભલામણ કરી કે દરબાર માં આવેલ હતા ને તે બાદ શહેર ગામ ગામ ના
તરફ વગર [illegible] [illegible] શાળા મંડપમાં બેસાડેલ હતા તે પુષ્પ [illegible]
[illegible] તે [illegible] [illegible] હતા. તે બાદ [illegible] શ્રી લક્ષ્મીનારાયણની
[illegible] [illegible] [illegible] શાસ્ત્ર ઉપર વાંચ્યા આવેલ હતા
તે [illegible] ગાડા ઉપર [illegible] ને ઉપર સારી રીતે રથ નો આકાર
કરી શ્રી ભગવાન ને તે રથ ઉપર બેસાડયા હતા ને તે રથ ગામ
ના દરવાજે તરફ થી [illegible] [illegible] ગામના પાદર તરફ વળી ને
ગામ ને પ્રદક્ષિણા કરાવી [illegible] દરવાજા બહાર લઈ ને શ્રી ભગવાન
ના મૂર્તિઓ ને હવન કુંડ ના બાજુમાં બેસાડેલા કરવામાં આવ્યા
હતા ને બ્રાહ્મણોએ હવન ચાલુ [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] શરૂ. બેઉ ઉપરથી ગાયો રહ્યા હતા. કે બાબતનું શરૂ.
વહીવટ [illegible] [illegible] તેવું હતું ને ગામ લોકો શ્રી લક્ષ્મી
નારાયણ ભગવાન ના જય બોલાવતા રહ્યા હતા શ્રી ગણપતિ
ના જય બોલાવતા રહ્યા હતા [illegible] [illegible] ના જય બોલાવતા રહ્યા
હતા ને [illegible] [illegible] [illegible] પ્રભુ ના દર્શન કરે [illegible] લાગ માં
[illegible] [illegible] પ્રભુ ના દર્શન [illegible] [illegible] થઈ રહી હતી
તે બાદ [illegible] [illegible] [illegible] લોકો [illegible] પોતાના ઉતારા
ના [illegible] માં બેઠા હતા. તે બાદ ભગવાન પ્રસાદ ના તૈયારી
થઈ હતી [illegible] [illegible] તેમ બાદ.
[illegible] [illegible] [illegible] [illegible] માં આવેલ હતા [illegible] [illegible]
પ્રમુખ સાહેબ [illegible] ના [illegible] [illegible] ના [illegible] [illegible] [illegible]
[illegible] હતા. [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] હતા. તે બાદ પ્રમુખ સાહેબ પોતાના [illegible] તથા પોતાના
પ્રમુખ તરીકે [illegible] [illegible] [illegible] હતા ને તે [illegible] મહારાજશ્રી [illegible]
[illegible] ને [illegible] પ્રમુખ સાહેબ પુષ્પ [illegible] [illegible] [illegible] હતા તે
બાદ સભાનું કાર્ય આરંભ થયેલ હતું.
૧ પ્રથમ પ્રમુખ [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible]
ને પુષ્પ [illegible] [illegible] [illegible] માટે શરૂ [illegible] [illegible]
[illegible] હતા ને હું [illegible] [illegible] [illegible] [illegible] આ ગામ ના
[illegible] [illegible] - મહારાજશ્રી ને [illegible] [illegible] [illegible]

realpatidar.com

https://archive.org/details/bk1047/page/n5/mode/1up

KJ-BK-3-24

realpatidar.com

લોકોએ આટલું પરશન પૂછી. ને આ બાબતોમાં ભાગ લીધો તે બદલ. આ ભાઈ ~~...~~ ~~...~~ ઠરાવેલ એટલા ફરજ. જુદી જુદી તેને દાખલ. લોકોએ. આપ્યા હતા. તે ઠરાવ. મંજુર. કર્યુ હતું.

૨ તે બાદ. પૂજ્ય મહારાજ શ્રી. આદિત્યરામજી. એમનું પ્રવચન. આપ્યું હતું. આપણા. હીન્દુ શાસ્ત્રમાં. આપે. હીન્દુ. આ મુસલમાન. લોકોએ. બળાત્કારે હીંદુ. તેના ઉપર જુલમ કર્યા હતા — ઈશ્વર કહે છે કે. બધા કહી જીવજો — ધર્મમાં જે. જે શક્તિ. જગત લીધા. પછી. એ તેમના ધર્મ. જુલમ. ન જોયા જોઈએ — તે ભગવાનના. ગુણ. ગાન. આ ભાઈ ઈશ્વરના. દાખલ. લોકોને આપી ન લાગતા રહસ્યમાં. શક્તિ જગતને. શાસ્ત્રના. હતા

આ. ગામમાં એવું શક્તિમાં જે પાટીદાર પણ. તે આધાર. છે પણ ધર્મ. ગામે. તે આપે. પણ. ~~...~~ તકરાર. નકુશાન. જેના. ભાઈઓ બધું. કરી હતી. જેના. ઉપરથી. સંપીલા એવા. મોટા. હુકમ. ઉપરના દાખલા આપીને. હતા. ને તેના ઉપરથી. પુનુ ને ગામ તે માર્ગે ઉતરવા. લોક. આપણ. જરૂર. પુનું ના બાળકો શાખ ને ઠાર્યો કરવાનું છે — ~~...~~ લેવું. ગામ. શક્તિના હીત માટે. આ શાસ્ત્રના ધર્મ. હીંદુ ધર્મ. ઉપર ખાલ પુ જેના. ચારણ ચાર ભાઈઓએ. કરી. હતી તે તેના. ગામ. રહીયા. દાખલા. આપ્યા. હતા. લોકો ~~લોકો~~

૩ તે બાદ નીમાયેલા. પ્રમુખ ભાઈ લાલજી. ત્રિકમ લાલ હેમરાજ ભાઈ ના આભાર. આ ડૉ. હરીલાલ. ના આભાર. આ. ગામ. પહેલા એવા આભાર. આપેલ. હતા. આ. હું ~~...~~ જયારથી પૂજ્ય મહારાજ શ્રી ને. જોયા. પછી હું. જે ભાવથી ~~તે~~ જે ~~...~~ આ શક્તિ જાગેલા ઉત્પાદન છે. ને તેના આશા. પ્રતાપે. જરૂર ફરી. સુધાર. થયો છું. તે તેમના. ને. જે. આશીર્વાદ આપેલ છે ~~તે~~ ખાસ ઈશ્વરી. પ્રેરણા. છે. તેમ. તે બાદ. આવું લાગ્યું. છે તે. ઠરાવ. ત્રિકમ લાલ હેમરાજ ભાઈ ને ભાગ્યા. આભાર. કર્યા. હતા. તાળીઓ —

realpatidar.com

૪ બાદ. હેમરાજભાઈ પોતાનું વક્તવ્ય. આપું. કર્યું. હતું. જે તે. દુઃખમાં ભળાવ્યું હતું. ગામ. બાબત. ચોખ્ખું. કરવા કરતા. એમ શરૂ. ઉપર. ભાર મુકીએ છે. તે. ~~...~~ હું. જ્યારથી. જાણતો થયો છું ~~...~~ ઉમેદ આપના શક્તિ ના શબ્દ. રહી. ને પુરો. ગ્રંથ. ને હીંદુ. તરીકે ની ફરજ. શાસ્ત્રમાં. આપેલ. છું. ને હું પણ. ~~...~~ ~~...~~ આપવા. બાબત. એવા. આ. શક્તિને. આપીશ. આ. માટે દાખલ ~~...~~ વિચાર્યું છે ને વિચારવાના શુભ છે. આ. પછીથી ~~...~~ જયારથી. હું વિચારીને જોયું. ત્યારથી તેમાંથી ફરજ. પ્રકાશ. છે. ને જેના આપે બાબતમાં હતા. ત્યારે ~~...~~ આ. શક્તિને ઉન્નતિ ને માર્ગે. એમ. પડેલ

https://archive.org/details/bk1047/page/n6/mode/1up

-Anandpar Meeting -for Laxminarayan Temple Inauguration (1047)

KJ-BK-3-25

realpatidar.com

ગુરુજને. શુભેચ્છા ચાંદ ૧ ફુલડું. મોકલ રજુ કર્યું. જેમાં. મિસ્ત્રી. જેઠા
ભાઈ. ફુલચંદ પ્રાગજી ના. શહીદ. ને રાખવા રોજ નક્કી કર્યું. પણ
સમાજે ધુપેલીઓને ફંડ. કારણે વખત. [illegible] ને ઘણું ભાગ્યું થયું.
તેબાદ. મેડલ. ધરી. લખ્યું. જેના હું શક્તિ નથી. મા.શ્રી. ફુલ
ગ્રહણ કરેલ સમર્પ્યું છું. તે બાદ. મિસ્ત્રી. લક્ષ્મણ. રામજી. દામજીભાઈ. સાથે
હતા જેના કેશર આ લાવ્યાં. તમામ. સભા. પર. હતા. ને આમ શરૂ
ઉપર ચાર. મુકુટ. જેને ઉપયોગે કરવા. પુજ્ય મહારાજ શ્રી. [illegible]
નક્કી કરેલ પાડી હતી. [illegible]. તાળીઓ

૫ મહારાજ શ્રી. અધિપરમાત્મા [illegible] લાવ કેસર લાવે. ને આમ
શરૂ. વાપરવા. જેના ઉપર ગયું. કેશર લાવેલ. આમ ના ગુણ
આપે. છે. કુળ ધરતું. આગળ કરેલ. આમ આ કેશર ના ભાગ ભાગના
આપવા. નાથ નાભોર તેઓને. દામજીભાઈ. સાથે હતા.

૬ ઈશ્વર ના લગન દેવશી ઠાકર. ઉભા. થયા હતા ને તેમને મુખી શક્તિમાં
પેડલ લુહ. ને ઉપર. આ. ભાગ કરવા. રહ્યા. સાથે હતા. પુજ્ય મહારાજ
શ્રી. અધિપરમાત્મા ને હું શરણ છું. જેના. આશીર્વાદથી. ને કોટ. લીધું
છું. તે. તેઓએ જ. સમાજનું. ફુલ છે. આ લગ્ન. સનાતન. ધર્મ પાળનાર
લાવે સને [illegible] વેલાગ્રેજ. લોકમત કરવું હતું (તાળીઓ)

૭ શ્રદ્ધુ. દયાળજીભાઈ ઉભા થયા. હતા. ને. આવતા. શરત. ના આભાર
માને. હતા. હું. આપના શક્તિએ શોધું. તોય અભાર કરેલ. ચાંદ કરેલ
આપ્યું છું. ને પુજ્ય મહારાજ શ્રી ને. મિશ્ર. સામ શક્તિમાં. પુજ્ય કરવા. મને
મિશ્ર. કરેલ પાડ્યું છે. ને. માટે કરેલ. આપના. શક્તિ ને સનાતન ધર્મ
પાળન સાધે. જેને હું શાસ્ત્ર. પ્રમાણ ગુણ. સ્થાપું છું. તેબાદ. પતિવ્રતા
ના ધર્મ [illegible] — [illegible] ચુકવ્યું ને [illegible] રજુ કર્યું
કર્યું. [illegible] — [illegible]. ને જવાન. હૈયે. ને વધારે. તેમના
[illegible] — [illegible]. [illegible] કરવા. મનાવ્યું
જેને [illegible] — [illegible] ના [illegible] જેના
[illegible]. સાથે હતા. ને. પિતાને. મિશ્ર. લાવ્યા આ શક્તિ જેવું
માટે. ભાષણ. ફેર લોકમત કર્યું હતું [illegible] — તાળીઓ

૮ તેબાદ ડૉ. હીરાલાલ નારણ પોતાના લેખ અને ભજન કર્યું હતું.

realpatidar.com